





**AMOUNT OF SHARE CAPITAL OF THE COMPANY AND CAPITAL STRUCTURE:** As on the date of the Red Herring Prospectus, the Authorized Share Capital of the Company is Rs. 25,00,00,000 divided into 81,70,00,000 Equity Shares of Rs. 10 each. The Issued, Subscribed and Paid-Up Capital of the Company is Rs. 8,17,00,00,000 divided into 81,70,00,000 Equity Shares of Rs. 10 each fully paid up. For details, please see the section titled "Capital Structure" beginning on page 65 of the Red Herring Prospectus.

**NAMES OF THE SIGNATORIES TO THE MEMORANDUM OF ASSOCIATION OF THE COMPANY AND THE NUMBER OF EQUITY SHARES SUBSCRIBED BY THEM:** The names of the signatories of the Memorandum of Association of the Company and the number of Equity Shares subscribed for by them at the time of signing of the Memorandum of Association:

S. No	Name	No of Shares Allotted
1	Mr. Tusharkumar Vithaldas Tilva	1,990
2	Mrs. Niruben Tusharkumar Tilva	1,000
3	Mr. Jimmy Tusharkumar Tilva	3,000
4	Mr. Sagan Tusharbhais Tilva	3,000
5	Mrs. Tilva Komal Jimmy	500
6	Mrs. Tilva Rency Sajan	500
7	Mr. Bharat Bhikhabhai Chavda	10

**Listing:** The Equity Shares offered for Red Herring Prospectus are proposed to be listed on the SME platform of National Stock Exchange of India Limited ("NSE Emerge"). Our Company has received 'in-principle' approval from NSE for listing of the Equity Shares pursuant to letter dated 11<sup>th</sup> March 2025. For the purpose of this issue, NSE shall be the Designated Stock Exchange. A signed copy of the RHP and Prospectus shall be filed with NSE in accordance with Sections 26(4) and 32 of the Companies Act, 2013. For details of the material contracts and documents available for inspection from the date of the RHP up to the Bid/ Issue Closing date, see "Material Contracts and Documents Available for Inspection" on page 424 of the RHP.

**DISCLAIMER CLAUSE OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA:** Since the issue is being made in terms of Chapter IX of the SEBI ICDR Regulations, 2018, a copy of the Red Herring Prospectus has been filed with SEBI. After filing the Red Herring Prospectus with the Registrar of Companies, in terms of Regulation 246 of the SEBI ICDR Regulations, 2018, read with section 26 and 32 of the Companies Act, 2013. Accordingly, SEBI has not issued any observation on the issue document in terms of Regulation 246 (2) of the SEBI ICDR Regulations, 2018, hence there is no specific disclaimer clause of SEBI. However, Investors may refer to the "Disclaimer Clause of SEBI", beginning on page no. 348 of the Red Herring Prospectus.

**DISCLAIMER CLAUSE OF STOCK EXCHANGES:** It is to be specifically understood that the permission given by NSE should not in any way be deemed or construed that the Offer Document has been cleared or approved by NSE nor does it carry the correctness or completeness of any of the contents of the Offer Document. The investors are advised to refer to the Offer Document for the full text of the "Disclaimer Clause of NSE" beginning on page no. 350 of the Red Herring Prospectus.

This being a public issue of equity shares, no credit rating is required.

#### CREDIT RATING

#### TRUSTEES

This being an issue of Equity shares, appointment of Trustees is not required.

#### IPO GRADING

Since the issue is being made in terms of Chapter IX of the SEBI ICDR Regulations, there is no requirement of appointing an IPO Grading agency.

**General Risk:** Investments in equity and equity-related securities involve a degree of risk and investors should not invest any funds in this issue unless they can afford to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in the issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the issue including the risks involved. The Equity Shares issued in the issue have not been recommended or approved by SEBI, nor does SEBI guarantee the accuracy or adequacy of the Red Herring Prospectus. Specific attention of the investors is invited to the section "Risk Factors" on page 33 of the RHP.

#### BOOK RUNNING LEAD MANAGER TO THE ISSUE

**Jawa Capital Services Private Limited**

CIN: U74100DL2005PTC13760

Plot No. 93, F/F, Pocket-2, Near DAV School, Jaspoti, Delhi-110025

Tel: +91-11-47366600, Email: mdo@jawacaptial.in

Investor Grievance Email: investor@jawacaptial.in

Website: www.jawacaptial.in

Contact Person: Mr. Taramveer Singh/Mr. Anoop Kumar Gupta

SEBI Registration No.: MB/INM000012777



## સમાચાર સંકલેપમાં

### ધુતારપર ગામે પવનચક્કીના ટાવરમાંથી

#### ક્ર. 61 હજારના વાયરની ચોરી

જામનગર, તા.૨૮: જામનગર નજીક ધુતારપર ગામમાં આવેલા પાનગી કંપનીના પવનચક્કીના ટાવરમાંથી ક્રોઈ તરફનો ક્ર. 61 હજારની કિંમતના ક્ષેપર વાયરની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત પવનચક્કીના ટ્રાન્સફર્મરમાં તોફાની કરી પાની ઓઈલ વગેરે ઢોળી નાખ્યું હતું. જેના કારણે અંદાજે ૬ લાખનું નુકસાન પણ થયું છે. જે નુકસાની અને તોફાની બનાવ અંગે પાનગી કંપનીના ક્રમચારી હરદાસભાઈ પરમતભાઈ કચંગીયાએ પંચશ્રેણી એ પિટીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તરફનો શોધવા તપાસ હાથ ધરી છે.

### બોટદાસ અપહરણના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

બોટદા, તા.૨૮: બોટદા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપીને બોટદા એલ.સી.બી.એ ઝડપી પાડી કાર્યાલયી હાથ ધરી હતી. અપહરણના કેસમાં નાસતો આરોપી કાના પ્રેમજીભાઈ જાજીયા રાજકોટ જિલ્લાના સોમપ ગામ માતે હોવાની મામતી એલ.સી.બી. ટાઈકાને એએસ.આઇ. ભુરાભાઈ ભગમુકાદ શાવડ તથા એ.એસ.આઇ. રામદેવભાઈ દેવુભા માંરી સહિતનાઓને મળતા પાતળીના આધારે બોટદા એલ.સી.બી. દ્વારા રાજકોટ જલ્લના ગામ પાંતેથી આરોપી કાનાજ ઉર્ફે કાને પ્રેમજીભાઈ જાજીયા (સં. સોમપ, જા.રાજકોટ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

### જામનગરમાં વાહનની ઠોકરે મહિલાનું મૃત્યુ

જામનગર, તા.૨૮: જામનગર લાલપુર બાપાપાસ ચોકડી પાસે ક્રોઈ અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ૬૫ વર્ષીય જામનાઈ નકુમ અને તેમના પત્ની દયાબેન જામનાઈ બન્ને ગંભીર રીતે યાવલ થયા હતા. બન્નેને સારવાર માટે જામનગરની સરકારી જી.હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટ્રેનના દરમિયાન દયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેમના પતિ બાઈક ચાલક જામનાઈ નકુમને કાળજીના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર અપાઈ છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક દયાબેનના પુત્ર નવીનભાઈ જામનાઈ નકુમે પંચશ્રેણી બી.ટી.વિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મુત્તરકંઠનો કમજોર સંભળી પોસ્ટ મૅટ્રેમ કરાવી અજાણ્યા વાહન ચાલકનો કબજો જામનગર હાથ ધરી છે.

### રબારીકામાં ખેડૂતનો કૂવામાં ઝપલાવી આપઘાત

જામનગર, તા.૨૮: જામજીધર તાલુકાના રબારીકા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પંચજીભાઈ દેવશીભાઈ ચાવડા નામના ૪૩ વર્ષના આદિવાસી જાતિના ખેડૂત યુવાને પોતાની કાસીના કૂવામાં ઝપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મુત્તમ નાનાભાઈ ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં જામજીધરના પોલીસ બનાવના સ્થળે પહોંચી મુત્તરકંઠને પાછીમારી બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ કર્યવહાર હાથ ધરી હતી. મુત્તક ખેડૂત યુવાનના ૧૦ વર્ષ પહેલાં દુરોગ્રાસ થઈ ગયા હતા અને નાસ્યા થીતે એલકાવ્યું જાન જીવતાં હતો. એલકાવ્યા જાનચીની કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

### કડિયાની ગામે વીજ આંચકાથી યુવાનનું મૃત્યુ

અમરેલી, તા.૨૮: મુળ ઉત્તરદેશના વતની અને હાલ રાજુલાના કસિયાની ગામે રહેતા કલોનાની રહેતા સરજન જાવલભાઈ રાજુભાઈ નામના ૧૯ વર્ષીય યુવક તા.૨૮મીએ તાર ફેસીની ઉપર અવાક ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવકનું મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.

### દલેલકાયા વાણ પર કપડા સૂકવતા સમયે શોટ લાગતા યુવકનું મૃત્યુ

અમરેલી, તા.૨૮: મુળ મધ્યદેશના વતની મુશ્કા રામસિંહ અનાનર નામના ૩૭ વર્ષીય યુવક તાર ૨૮ના સવારે દલેલકાયા ગામ નજીક નેશાલ વાણ પર કપડા સૂકવવા ગયા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકની ઈલેક્ટ્રીક વાયર પસાર થતાં હોય જે ઈલેક્ટ્રીક વાયર ઉપર પોતાના કપડા સૂકવવા જતા અનાનર યુવકને ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવકનું મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.

## જામનગરમાં રિશ્તાયાલક યુવાનને છેતરનારી લુટેરી દુલ્હન ઝડપાય

### રાજકોટની એક મહિલાની પાપ ભૂમિકા સામે આવતા હાથ ધરાઈ તપાસ : રાગાઈ મહિલા સહિત બેની કરાઈ લીટી અડકાયત

જામનગર, તા.૨૮: જામનગરના રિશ્તાયાલક યુવાન મહારાષ્ટ્રના આક્રોવાની એક લુટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો અને ૩૨.૩૦ લાખ ગુનામાં હતો જે પ્રકરણમાં લુટેરી દુલ્હનને પોલીસે શોધી અને તરીબે અડકાયત સમજ રજૂ કરતાં જેમાં પોલીસે દેવાઈ છે. આ પ્રકરણમાં કુલ ત્રણ આરોપીઓ પકડયા છે જ્યારે રાજકોટની વધુ એક મહિલા આરોપીનું નામ પુલ્ક્ય છે.



બેંડી વિસ્તારમાં રહેતા અને રિશ્તા ચલાવતા ખીમજીભાઈ મુશાભાઈ મકરાવા નામનો ૩૯ વર્ષનો યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો અને લગ્ન કરી લીધા બાદ યુવતી બીજા દિવસે જ પેસા લઈને ભાગી છૂટી હતી. જે

### અમદાવાદમાં ગેરકાયદે દુલ્હનના ઝડપાયું

અમદાવાદ, તા.૨૮: અમદાવાદમાં એસ.જી હાઈવે પર સરેલજી મહંમદપુરા રોડ પર આવેલા રજેટ કેમ્પમાં હાલથી દુલ્હનના નામની કિલેટની યુક્ત તપાસવાળા દુલ્હન ઝડપાયેને પેસાવામાં આવ્યાં છે. આ બાતપત્રીઓને પોલીસે તાત્કાલિક દરોડે પાડ્યા કેમ્પમાં કાયમીત તપાસવાળા પુલ્ક્ય થઈ ઈ.ટી. દરોડા દરમિયાન ૧૩ જુદા-જુદા લેવેરના કિલેટની યુક્ત દુલ્હન સહિત કુલ ૩૫ હજારની વધુનો મુશાબજ જાનકરવામાં આવ્યો હતો. જાન કાયદાકીય લેવેરને સેરેસિટી તપાસ માટે એફ.એસ.સેલમાં

મોકલવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જુ રોડેટ કેમ્પ નામની સ્ટેડેરની આજ્ઞા આ હુકુમાર ચલાવવામાં આવતાં હતો. કેમ્પે મહિને ૧૦ હજાર રૂપિયાના ભાડે ચલાવવામાં આવતાં હતો અને તેની માલિકી ગાંધીનગરના દિવ્યરાજસા ચાવડા, વિનય તિવારી અને જુહાપુરાના હમીદની ભાગીદરીમાં હતી. આજ્ઞાનો સંચાલન પેસા આ હુકુમારનું સંચાલન કરતાં હતો. જ્યારે હમીદ હક નામના શાય પણ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

### સુરતમાં મનપાની કચરાગાડીના ચાલકે કિશોરને અડકડે લેતા મૃત્યુ

સુરત, તા.૨૮: મુળ મહારાષ્ટ્રના વતની અને ઉપનામના શિવનગરમાં રહેતો કાર્તિક અલિવ નેહરો (૬.૧૩) રાત્રિના સમયે પોતાના બહેનો સાથે મોપેડ પર ઘરની નજીક સોડા પીવા નીકળ્યો હતો. તે સમયે મનપાની કચરાગાડી અવાક પૂરપાટ ઝડપે આવી ટર્ન લઈને મોપેડને અડકડે લેતા બંને બહેન અને કાર્તિક ગંભીર રીતે ઈજા પ્રસં થયા હતા. ગંભીર ઈજાને પગલે કાર્તિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. તાત્કાલિક કાર્તિકના મુત્તરકંઠ નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં હતો. આ સાથે જ ઈજાગ્રસ્ત થયેલો મૃતક ચાલક અને તેની બહેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

## સુરતમાં બે શખસે મસિડીઝ કરાને આગ ચાંપી

સુરત, તા.૨૮: વેસુની ગેલ કલોની વિસ્તારમાં કીકુષ્ઠા સોસાયટી પાસે નીલકંઠ નિવાસના પાર્કિંગમાં બે અજાણ્યા શખસે એક્ટિવા સુફર પર આગ ચાલુ કરી. આ ઈસમોએ ત્યાં પહેલી એક મસિડીઝ કાર પર કોટી જાનલનીલ પદાર્થ છાંટ્યો અને તરત જ એના પર આગ ચાંપી દીધી હતી. માત્ર સેકન્ડ-ગ્રે જ મોંઘી દાટ મસિડીઝમાં આગ પ્રચલવા લાગી અને ગાડીમાંથી કુસરો ઉડવા લાગ્યો. આગ લાગવાનું માલુમ પડતા પરિવારના સભ્યો ઘરમાંથી તાત્કાલિક દોડી આવ્યા અને આગ એલવાવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાડીના આગળના કચા, છાપડું, બોન્ટે અને એલિનના ભાગમાં ભારે નુકસાન થઈ

**KFIN TECHNOLOGIES LIMITED**  
Address: Sateem Tower-B, Plot 31 & 32, Gachibowli, Financial District, Nanamanguda, Serilingampally, Hyderabad - 500 032.  
Tel: +91 40 6716 2222; Toll Free No.: 1800 309 4001; Email: ap@kfinetech.com  
Investor Grievance Email: enquire@kfinetech.com  
Website: www.kfinetech.com  
Contact Person: Mr. Murali Krishna  
SEBI Registration No.: INR000002221

**COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER**

**Ms. CS Priyanka Sharma**  
Ganga Bath Fittings Limited (formerly known as Ganga Plast Industries Limited)  
Survey No. 121, Nr. Vraj Industrial Estate, SIDC Road, B/H Shanthanum Residency, Veraval (Shapur), Kotda Sangani, Rajkot, Gujarat 362024  
Tel No. : +91-9033836382; E-mail: cs@gangabathfittings.com  
Website: www.gangabathfittings.com

**GANGA**  
Redefining Bathing Experience

Investors may contact the Company Secretary and Compliance Officer or the Registrar to the Issue in case of any pre-issue or post-issue related grievances including non-receipt of letters of allotment, non-credit of allotted equity shares in the respective beneficiary account, non-receipt of refund orders or non-receipt of funds by electronic mode, etc. For all issue related queries and for redressal of complaints, investors may also write to the BRLM.

**Availability of Red Herring Prospectus:** Investors should note that Investment in Equity Shares involves a degree of risk and investors are advised to refer to the Red Herring Prospectus and the Risk Factors contained therein, before applying to the issue. Full copy of the Red Herring Prospectus is expected to be available on the SEBI's website (www.sebi.gov.in), and shall be available on the website of the Company (www.gangabathfittings.com), the website of the Book Running Lead Manager to the issue (www.jawacaptial.in) and on the website of NSE (www.nseindia.com).

**Availability of Abridged Prospectus:** A copy of the Abridged Prospectus will be available at the website of the Company www.gangabathfittings.com the website of the Book Running Lead Manager to the issue (www.jawacaptial.in) and the Registrar to the Issue at (www.kfinetech.com).

**Availability of Application Forms:** The Application Forms may be obtained from the Registered Office of our Company i.e. Ganga Bath Fittings Limited (Formerly Known as Gangs Plast Industries Limited), the Book Running Lead Manager to the Issue i.e. Jawa Capital Services Private Limited. Application Forms will also be available on the website of NSE (www.nseindia.com) and the designated branches of SCSBs, the list of which is available at the websites of the Stock Exchange and SEBI.

**Application Supported by Blocked Amount (ASBA):** All Applicants (other than Applicants using the UPI mechanism) shall mandatorily participate in the issue only through the ASBA process. ASBA Applicants (other than Applicants using the UPI mechanism) must provide bank account details and authorisation to block funds in the relevant bank account in the Application Form and the Application Forms that do not contain such details are liable to be rejected.

**Bankers to Issue:** Escrow Collection Bank and Refund Bank/ Public Offer Account Bank: Axis Bank Limited  
Sponsor Banks: Axis Bank Limited

**For Ganga Bath Fittings Limited (formerly known as Ganga Plast Industries Limited) On behalf of the Board of Directors**

**(JIMMY TUSHARKUMAR TILVA)**  
Managing Director  
DIN: 08950646

**Date: May 29, 2025**  
**Place: Rajkot**

**Ganga Bath Fittings Limited (formerly known as Ganga Plast Industries Limited)** is proposing, subject to applicable statutory and regulatory requirements, record of requisite approvals, market conditions and other considerations, to make initial public offering of its Equity Shares and has filed the Red Herring Prospectus with the Registrar of Companies, Ahmedabad. The Red Herring Prospectus is expected to be available on the website of the SEBI at www.sebi.gov.in and the website of the Book Running Lead Manager to the Issue at www.jawacaptial.in and website of the NSE Limited at www.nseindia.com and website of Issue Company at www.gangabathfittings.com. Investors should note that investment in Equity Shares involves high degree of risks. For details, investors should refer to and rely on the Red Herring Prospectus, including the section titled "Risk Factors" on page 33 of the Red Herring Prospectus. Potential Bidders should not rely on the DRHP filed with NSE for making any investment decision instead investors shall rely on RHP filed with the SEBI.

The Equity Shares have not been and will not be registered under the US Securities Act of 1933, as amended (the "Securities Act") or any state securities law in United States and may not be offered or sold within the United States (as defined in Regulation S under the Securities Act) or to, or for the account benefit of "U.S. Person" (as defined in the Regulations under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to the registration requirements of the Securities Act.

સારવાર માટે સ્મિરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હર્ષિતાબેનને સારવાર દરમિયાન કમ તોડી દીધી હતો. જેથી બનાવ અંગે પોલીસને જાણ થતા ઉના સુધાના પાસામાં રહેતા હર્ષિતાબેન ક્ષિત્રભાઈ સોલંકી (ઉ.ઉ.ઉ) સ્મિરે હોસ્પિટલ માટે સહાયક કમચારી તરીકે કામ કરતા હતા. હર્ષિતાબેન ગતરોજી નોકરી પરથી ઘરે પરત ફરી દીકરને કોન કરી કમ્પ્લે હતું, કે હું આવી કંઈકે કરીશ. જેથી તાત્કાલિક બનાવ અંગે જાણ થતા ઉના દીકરાની નજર સામે હર્ષિતાબેન પગલે તેમણે તપાસમાં હોવાની શક્યતા છે.

■ દીકરા સામે મહિલાએ ગટગટાવું એકિસ : લાખાંબોરના ગ્રાસથી પગલું ભરાયું પ્રાથમિક તપાસ

સુરત, તા.૨૮: સુરતની સ્મિરે હોસ્પિટલમાં સહાયક કમચારી તરીકે રજૂ બજાવતા એક મહિલા કમચારીએ ઘરે દીકરાની નજર સામે એકિસ હોવાથી આપઘાત કરી લેતા ચક્રાવર મચી જવા પામી હતી. દીકરે ઘરે પહોંચ્યાં હતાં અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં

### બગસરા નજીક ખેડૂત પર હુમલો : 6 સામે ફરિયાદ

અમરેલી, તા.૨૮: વિસાવદર તાલુકાના ભલગામ ગામે રહેતા મુશ્કાભાઈ મુશ્કાભાઈ મોટીયા નામના ૪૫ વર્ષીય ખેડૂત તાર.૨૭ના પોતાનું ટ્રેક્ટર લઈ બગસરા-માલોડાવા હાઈવે રોડ પર ન્યારા પેટ્રોલ પંથપી બેઠેલ બેટી પર પોતાના ગાય ભલગામ આવતા હોય તે દરમિયાન તે જ ગાય રહેતા હાથમાઈ બાવકુભાઈ બસીયા તેમજ બે અજાણ્યા પુરુષ બુલેટ વાહન પર આવી ટ્રેક્ટરની પાછળ બેસી જઈ એકદમ અચાનક પાછળથી આવી ખેડૂતનું ગળુ પકડી દઈ તેને નીસે પાડી દીધેલા હતા. આરોપીએ હાથમાં લોખંડાં પાકાઈ લઈ ખેડૂતનો માર મારેલો હતો. બાદમાં આરોપી ભવતીય હાથમાઈ બસીયા, સંધ્યા જાેતુભાઈ બસીયા તથા એક અજાણ્યો પુરુષ સહકે કબરની કોરડીલકામાં આવી ખેડૂતને જેમ હાવે ગઈ ખેડૂતનો મોભાઈલ તોડી નાખી નુકસાન કરી તથા ખેડૂતને માર મારી જાત્રી મારી નાખવાની ચમકી આપવાની ૬ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

### કુતિયાણામાં મિલકતના મનદુ:ખમાં હુમલો

પોરબંદર, તા.૨૮: પોરબંદરના એરપોર્ટ સામે રહેતા દિલેશ નાથભાઈ ઓઝેરના નામના ૩૭ વર્ષના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા નાથભાઈ ઓઝેરના મૃત્યુ પાછા પછી ભાઈઓની મિલકત પાસે ભાગ પાડવાની વાતચીત ચાલુ હતી અને તે બાબતે નાના પ્રજ્ઞક થવા થતા દિલેશ ઓઝેર તથા તેના ભાઈ મીરો કેટા કરામં કુતિયાણા ગયા હતા. દિલેશનો ભાઈ કાડ નાથા ઓઝેરના અને ભત્રીજો આકાશ દીકરા ઓઝેરના બેને ફરિયાદીને 'તું બે કમ આપ્યો છે?' તેમ કહેતા ફરિયાદીને, જે બે કમ અપાઈ અંતર પુરુષા અને મળવા આવ્યા છે.' તેમ કહેતા ફરિયાદીની ભાઈ કાડ અને બે ભત્રીજા કુશલ અને આકાશ તથા બંને ભાઈઓ શોભાબેનનું કળુ અને શોભાબેનને દીપ્ત ઉઠેકરું ગયા હતા અને ગળી આપવા લાગ્યા હતા. કળુને પાકા વડે અને છત્રીની માર માર્યા હતાં ફરિયાદીની માર મારીને 'આજે તો તને જવા જ નથી દેવો પતાવી જ નાખવો છે.' તેમ કહીને ધમકી આપ્યા હતાં અને કુતિયાણા પોલીસ આ બાતમાં ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી.

### પિતાએ પબજી ગેમ રમવાની ના કહેતા પુત્રનો ગળાફાંસો ખાઈ આપઘાત

■ હળવાઈનાં નવા દેવગિળિયા ગામનો બ્રાહ્મણ મારેલી, તા.૨૮: હળવાઈના નવા દેવગિળિયા ગામે રહેતા યુવાનને પિતાએ મોભાઈલમાં પબજી ગેમ રમવાની ના પાડ્યા પબજી ગાળાફાંસો ખાઈ આપઘાત પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય વાતનું છે. હળવાઈના નવા દેવગિળિયા ગામે રહેતા જયેશ અર્જુનભાઈ નાયક (ઉ.ર.૩) મોભાઈલમાં પબજી ગેમ રમતો હોય અને ખેતી કરતા હતા ના હોય જે બાબતે તેના પિતા અર્જુનભાઈએ જમતી વખતે ઈશ્કો આપ્યા હતાં. જયેશને આ વાતનું લાગી પાડતા આરંભમાં ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે હળવદર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

### ભાવનગર-ઓખા ટ્રેનનો સમય સાંજથી બદલાયો

જામનગર, તા.૨૮ : જામનગરના મુસાફરોની માગણીને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં તા.૩૦થી ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ૧૯૦૨૦ ભાવનગર-ઓખા ટ્રેન રાત્રે ૧૦:૧૦ કલાકે ભાવનગરથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ઓખા પહોંચશે. વર્તમાન સમયકે સત્તા ઓખા થી કલકેટ પહોંચી પાસે છે. જે સુરેન્દ્રનગર સવારે ૧૨:૧૫, વાવનગર રાત્રે, રાજકોટ ૩:૪૬, હાપા ૫:૪૦, જામનગર ૬:૦૨, ખંભાળિયા ૭:૨૦, દારક ૮:૫૦ તથા ઓખા ૧૧ વાગ્યે પહોંચશે.



યુક્ત્યું હતું. કારના માલિક આચાર્યલલિત અને પરિવારજનોએ દાવો કર્યો છે કે, આ કાગડાની જી અલવાન કારણે હુમલામાં આવી છે. કારના

માલિકે સમજ ઘટના અંગે રૂઝ મોબીલ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજીના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.